



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૧/૦૮/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૬૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૧ કેસ કરી, ૩૨ વ્યક્તિઓને ઝડપી, ૧૯૯ લીટર દેશી દારૂ, ૩૯ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૯૦ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૫૭ બિયર ટીન અને ૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૫.૧૪૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૬૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૪૬૫/૧૯

**કૃષ્ણનગર:** જીવીબહેન તે પરષોતમભાઈ જેઠાભાઈ જોગાણી નાઓની વિધવા પત્ની (ઉ.વ.૬૫) (રહે. સત્ય નારાયણ સોસાયટી રતનબા સ્કુલ સામે ઠક્કરનગર રોડ કૃષ્ણનગર) એ તા.૩૦/૦૮/૧૯ નારોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨૦/૦૮/૧૯ નારોજ જીવીબહેનને બાપાસિતારામ ચોક નજીક અજાણ્યા ચાર પુરૂષોએ પૈસાનું બંડલ બતાવી જીવીબહેન પાસેના સોનાની બંગડી નંગ-૨ કિંમત રૂપિયા ૧૫,૩૬૦/- અને સોનાની ચેઈન કિંમત રૂપિયા ૫૯,૦૦૦/- રૂમાલના પડીકામાં મુકાવી રિક્ષામાં બેસાડી યુક્તિ-પ્રયુક્તિ કરી નજર યુકવી ચોરી કરી જીવીબહેનને વેરા નજીક રિક્ષામાંથી ઉતારી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.એમ.ગોહીલ ચલાવે છે.

**સોલા હાઈકોર્ટ:** શીતલબહેન ઓમપ્રકાશ અગ્રવાલ (રહે. ડિવાઇન હાઇલેન્ડ સાયન્સ સીટી સોલા) એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે બે વર્ષ અગાઉથી તા.૨૮/૦૮/૨૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન પોતાના ઘરે કામ કરતા આરોપી હરીશ મરતાભાઈ તબીયાડ (રહે. સિલ્વર ઓફ કોલેજ સોલા) પોતાના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૫,૯૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગયો છે. આ ગુનાની તપાસ ચલાવે છે.

**સાબરમતી:** (૧) સુરેશભાઈ મજાભાઈ રાવત (રહે. પુનીત સોસાયટી રાણીપ) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૮/૧૯ બપોરના ૧/૦૦ વાગ્યા પહેલા પોતાના ઘરે લાકડાની વળી સાથે સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી રમણજી રામાજી ચલાવે છે.

**સાબરમતી:** (૨) મનિશાકુમારી વા/ઓ લોકેશ મીણા (ઉ.વ.૨૦) (રહે. શિલ્પા સોસાયટી ડિ કેબિન સાબરમતી) એ અગમ્ય કારણસર તા.૩૦/૦૮/૧૯ કલાક ૧૨/૪૦ વાગ્યા પહેલા પોતાના ઘરે છતના લોખંડના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.ઇ.શ્રી આર.એચ.વાળા ચલાવે છે.

**એલીસબ્રીજ:** મનીષાબહેન વા/ઓફ કમલેશભાઈ જીતીયા (ઉ.વ.૨૯) (રહે. મહેનતપુરાના પાટીયા શારદામંદીર સ્કુલ સામે આંબેડકર કોલોની આંબાવાડી) એ અગમ્ય કારણસર તા.૩૦/૦૮/૧૯ કલાક ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે એલીસબ્રીજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી પર્વતસિંહ વેચાતભાઈ ચલાવે છે.

**અમરાઇવાડી:** મનીષાબહેન ડો/ઓ દલપતભાઈ સોય (ઉ.વ.૧૯) (રહે. બ્લોક નં પી/૫૩/૧૦૧ મહાલક્ષ્મીનગર અમરાઇવાડી) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૮/૧૯ સવારના ૯/૩૦ થી રાતના ૯/૧૫ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા ચલાવે છે.

**રીવરફ્રંટ ઈસ્ટ:** મુકેશભાઈ પટણી (ઉ.વ.૩૨) (રહે. નર્મદાબેનની ચાલી ઓમનગર મેઘાણીનગર) એ અગમ્ય કારણસર તા.૩૦/૦૮/૧૯ બપોરના ૧/૧૫ વાગ્યા પહેલા રિવરફ્રંટ વાડજ તરફ દશામાના મંદિર સામે નદીમાં પડી ડુબી જઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રંટ ઈસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મોતીભાઈ તળજાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.